#### **ASHNISHA INDUSTRIES LIMITED**

19<sup>th</sup> July, 2025

To,
Department of Corporate Services
BSE Limited
Ground Floor, P. J. Towers,
Dalal Street, Fort,
Mumbai - 400 001

Security ID: <u>ASHNI</u> Security Code: 541702

Dear Sir/Madam,

Sub: Newspaper Advertisement of 16<sup>th</sup> Annual General Meeting for the Financial Year 2024-25, including Book Closure and e-voting information etc.

Please find enclosed herewith copy of Advertisement of Annual General Meeting to be held on Tuesday, 12<sup>th</sup> August, 2025 at 3:30 P.M. IST through Video Conferencing (VC)/ Other Audio-Visual Means (OAVM) for the Financial Year 2024-25, including Book Closure and e-voting information published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Kindly take the same on your record.

Thanking You,

Yours faithfully,

For, Ashnisha Industries Limited

Ashok C. Shah Managing Director DIN: 02467830

Encl: As above



## દિલ્હીની મહિલાઓ સહેલી સ્માર્ટ કાર્ડ સાથે ડીટીસી અને ક્લસ્ટર બસોમાં મફત મુસાફરી કરી શકશે

નવી દિલ્હી

મહિલાઓ ગુલાબી ટિકિટ સાથે ક્રૂઝ બસની મફત સેવાનો આનંદ માણી શકશે નહીં. હવે દિલ્હીની આ મહિલાઓ 'સ્માર્ટ કાર્ડ' દ્વારા ક્રૂઝ બસમાં મફત મુસાફરી કરશે. આ અંગે સરકાર દ્વારા એક આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ દિલ્હીમાં રહેતી ૧૨ વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો 'સહેલી સ્માર્ટકાર્ડ' સાથે તિબેટનાં યારલુંગ ત્સાંગપોમાં ડેમની અસર માત્ર અરૂણાચલ ભારત સરકાર સાથે ચર્ચા-ક્રુઝ અને ક્લસ્ટર બસોમાં મફત ડિજિટલ કાર્ડ હશે, જે નેશનલ કોમન લઈને મુખ્યમંત્રી ખાંડૂએ ચિંતા શકે છે. જો ચીને પાણી વહેંચણી મોબિલિટી કાર્ડ ફ્રેમવર્ક હેઠળ જાહેર કરવામાં આવશે. આ સ્માર્ટ કાર્ડમાં ધારકનું નામ અને ફોટો હશે. સરળ શબ્દોમાં કહીએ તો આ કાર્ડ મફત પિંક પ્રદેશનું અસ્તિત્વ જો ખમમાં માટે થઈ શક્ચો હોત.' ટિકિટનું સ્થાન લેશે.

આ 'સહેલી સ્માર્ટ કાર્ડ'નો લાભ મેળવવા માટે. મહિલાઓએ ક્રુઝ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી પુરાવો, પાસપોર્ટ ફોટો અને કોઈપણ મુજબ ડુપ્લિકેટ કાર્ડ મળશે.

કરાવવી ૫ડશે. ઉપરાંત, બેંક બેંકના KYC જેવા દસ્તાવેજોની જરૂર દિલ્હીમાં DTC બસોમાં મફત શાખામાં જઈને દ્વરૂઝ પ્રક્રિયા પૂર્ણ પડશે. આ કાર્ડ મહિલાઓને રજિસ્ટર્ડ મફતમાં મુસાફરી કરી શકશે. પરંતુ નામે કૌભાંડનો સતત આરોપ લગાવી મુસાફરી કરતી લાખો મહિલાઓ કરવી પડશે. 'સહેલી સ્માર્ટ કાર્ડ'નો સરનામે પોસ્ટ દ્વારા મોકલવામાં માટે એક ખૂબ જ મહત્વપૂર્શ સમાચાર લાભ મેળવવા માટે, મહિલાઓને આવશે. જો આ કાર્ડ ક્ચાંક ખોવાઈ સામે આવ્યા છે. હવે દિલ્હીની લાખો આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનો જાય, તો મહિલાઓને બેંકની શરતો શકે છે.હાલની દિલ્હી સરકાર પણ (છહ્નઝજી) થી પણ વસૂલવું જરૂરી

બેંકો કાર્ડ જારી કરવા અથવા તેની રહી છે. આ ઉપરાંત, ક્રૂઝ બસોમાં જાળવણી માટે નજીવી ફી વસૂલ કરી ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ અગાઉની આમ આદમી પાર્ટી સરકાર રહેશે.

આ કાર્ડ સાથે, મહિલાઓ પર મહિલાઓ માટે મફત ટિકિટના

# ચીનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ પ્રોજેક્ટ ભારત માટે વોટર બોમ્બ

મુકાવાની આશંકા વ્યક્ત કરી છે.

ઈટાનગર, અરૂશાચલ ખૂબ જ ખતરનાક છે. ચીન પર આવી શકે છે. જો ચીનનો ડેમ લીલી ઝંડી આપી દીધી છે. વ્યક્ત કરી છે. તેમણે ચીનના કરારો પર હસ્તાક્ષર કર્યા હોત, તો જે પાણી સંગ્રહ અને સુરક્ષાની વિશાળ ડેમને 'વોટર બોમ્બ' આ પ્રોજેક્ટનો ઉપયોગ પૂરને

પ્રોજેક્ટ કોઈપણ આંતરરાષ્ટ્રીય વસતા આદિ જાતિ અને અન્ય સમયસર પોતાનો પ્રોજેક્ટ પૂરો જળ સંધિનો ભાગ નથી, તેથી તે સમુદાયોની આજીવિકા પર સંકટ કરશે તો પ્રને નિયંત્રિત કરી

નામની એક યોજના બનાવી છે, સીએમ પેમા ખાંડ્રએ વધુમાં તે કો ઈપણ પ્રકારની માહિતી

પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ વિશ્વાસ ન કરી શકાય. જો તેઓ પ્રોજેક્ટપૂરો થશે તો બ્રહ્મપુત્રા અને યારલુંગ જાંગ્બો નદીમાં ૬૫૬૧ ચીનના વોટર બોમ્બને લઈને અચાનક પાણી છોડશે તો સિયાંગ સિયાંગ નદીઓ બહોળા પ્રમાણમાં ફૂટની ઊંચાઈ પર આ ડેમ ભારતને ચેતવણી આપી છે. ચીન નદીનો સંપૂર્ણ વિનાશ થઈ જશે. સુકાઈ શકે છે. અરૂણાચલ સરકારે બાંધવાની શરૂઆત કરી દેવાઈ હોવાની આશંકા છે. થ્રી ગોર્જેસ બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી પ્રદેશમાં જ નહીં, આસામ અને વિચારણા કરી છે, ત્યારબાદ ડેમબાંધવાનો ખર્ચ ૩૪.૮૩ અબજ મુસાફરી કરી શકશે. આ એક વિશાળ ડેમ બનાવી રહ્યો છે, જેને બાંગ્લાદેશને પણ મુશ્કેલીમાં મુકી સિયાંગ અપર બહુહેતુક પ્રોજેક્ટ ડૉલર થશે. જેમાં વિસ્થાપિત થયેલા ૧૪ લાખ લોકોનું પુનઃવર્સન પણ કરાશે. નવો ડેમ દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની હશે. ચીને તિબેટ પઠારના પૂર્વીય છેડા પર, ગણાવ્યો છે અને આ ડેમથી આખા નિયંત્રિત કરવામાં મદદ કરવા ડેમ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ યારલું ગ જાંગ્બો નદી પર કરી દીધું હોવાની આશંકા છે અને બાંધવામાં આવશે. જે વાર્ષિક ૩૦૦ બિલિયન કિલોવોટ ઉર્જા તેમણે કહ્યું કે, 'ચીનનો ડેમ કહ્યું કે, 'સિયાંગ નદી કિનારે આપી રહ્યું નથી. જો ભારત ઉત્પન્ન કરશે. થ્રી ગોર્જેસ ડેમની ૮૮.૨ બિલિયન કિલોવોટ પ્રતિ કલાકની ડિઝાઇન ક્ષમતામાં ત્રણ શકાશે.' બીજીતરફ કેન્દ્ર સરકારે ગણો વધારો કરશે. ચીનના આ પણ માર્ચમાં સ્પષ્ટ કહ્યું હતું કે, પ્રસ્તાવિત ડેમમાંથી ભારત અને 'સરકાર બ્રહ્મપુત્રા નદી સંબંધીત બાંગ્લાદેશમાં લાખો લોકોને અસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે થશે. ચીનના સરકારી ઉર્જા અને દેશહિતમાં જરૂરી પગલાં ભરી નિગમના આ પ્રોજેક્ટથી દેશના રહ્યું છે.' ચીનના વિશ્વના સૌથી કાર્બન ન્યૂટ્રેલિટીના લક્ષ્યો હાંસલ મોટા ડેમની વાત કરીએ તો, મધ્ય કરવામાં મદદ મળશે. ચીનમાં સ્થિત થ્રી ગોર્જેસ ડેમ અધિકારીઓએ જણાવ્યું કે, વર્તમાનમાં વિશ્વનો સૌથી મોટો તેનાથી એન્જિનિયરિંગ જેવી ડેમ છે. ચીને તેનાથી પણ સૌથી ઇન્ડસ્ટ્રીમાં તેજી આવશે અને વધુ શક્તિશાળી ડેમને ગત વર્ષે જ તિબેટમાં રોજગારી સર્જન થશે

દુલ્હનને સુહાગરાત મનાવતા પતિ તો નપુંસક છે.

રોકવા માટે વરરાજાએ એવી તરકીબ અપનાવી. જેને જોઈને પત્નીના બધા અરમાનો પર પાણી ફરી વળ્યું. લગ્ન બાદ રાજીખુશીથી દુલ્હન વરરાજાની રાહ જોઈ રહી હતી. ત્યારે વરરાજો રુમમાં જાય છે. પ્રેમથી દુલ્હન પોતાની પતિને જુએ છે અને ધીમે ધીમે તેની નજીક જાય છે. અહીં સુધી તો બધું બરાબર હતું, પણ જેવું દુલ્હન પોતાના સાથે મારપીટ કરી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો. વરરાજાનો હાથ પકડે છે તરત જ તેનો હાથ છોડાવી નાખે છે અને ગુસ્સે થવા

દહેજની લાલચમાં છોકરીને નપુંસક

યુવક સાથે પરણાવી દીધી

## યુપીમાં એક જ પરિવારમાં છેલ્લાં ૧૭ વર્ષમાં ૧૦ લોકોનો આપઘાત

મેનપુરીમાં એક પરિવારમાં છેલ્લા પિતા) ખેતરો તરફ શોધવા નીકળ્યો ૧૭ વર્ષમાં ૧૦ લોકોએ આત્મહત્યા હતો. જોકે, બપોરે બે કલાકે સૂચના કરીને જીવન ટુંકાવ્યું છે. પરિવારના મળી કે નજીકના દહેડ ગામના ૧૮ વર્ષીય યુવક જિતેન્દ્રે આપઘાત સીમાડાની પાસેના એક ખેતરમાં વૃક્ષ કરી લેતા આ અંગેની ચર્ચા વધી છે. પર દુપટ્ટાથી લટકી રહ્યો છે. આ એક જ પરિવારમાં આપઘાતની ઘટનાના સમાચાર મળતાં રડતા-ઘટનાઓને લીધે ગામ લોકો પણ રડતા જ યુવકની માતા ચીસો પાડીને ભયભીત થઈ ગયા છે. પોલીસના કહી રહી હતી કે ભગવાને મારા પુત્રને કહેવા મુજબ, આ ઘટના સકત કેમ ઉપાડી લીધો. થોડા દિવસ પહેલા ગામની છે. મૃતકના દાદા હીરાલાલે જ પુત્રી જતી રહી, મારો દિયર પણ જણાવ્યું કે મારો પૌત્ર જિતેન્દ્ર સવારે જતો રહ્યો અને હજુ કેટલા લોકોને ૧૦ કલાકે ઘરથી ભોજન લઇને ખેતર ભગવાન મારશે. એમ કહેતા-કહેતા તરફ નીકળ્યો હતો. જિતેન્દ્રે કહ્યું હતું કે જાંબુ ખાવા જઈ રહ્યો છું, થોડા પહોંચી અને જરુરી કાર્યવાહી કરીને સમયમાં પરત આવી જઈશ. તડકો વધુ છે એટલે બહેનનો દુપટ્ટો લઈ જઈ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રહ્યો છું. જોકે, એ ઘણો સમય પસાર મોકલ્યો છે. થયો છતાં ઘરે પરત આવ્યો નહીં.

મેનપુરી, ઉત્તરપ્રદેશના એટલે મારો પુત્ર રામબરન(મૃતકના યુવકની માતા બેભાન થઈ ગઈ હતી. આ મામલામાં પોલીસે ઘટનાસ્થળે

લાગે છે. પછી તેને સમજાય છે કે તેનો લગ્ન માર્ચ ૨૦૨૪માં ઉજ્ઞાવ જિલ્લાના યુવક સાથે થયા હતા. કાનપુરમાંથી એક ચોંકાવનારો વિવાહની પહેલી રાતે મહિલાને કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જાણવા મળ્યું કે, તેનો પતિ શારીરિક મહિલાએ પોતાના પતિ પર નપુંસક રીતે અક્ષમ છે. તેણે બીજા દિવસે હોવાનો આરોપ લગાવ્યો છે. સવારે જેઠાણીને આ વાત કહી, પણ મહિલાનું કહેવું છે કે દહેજની તેમણે આ વાતને મજાકમાં લઈ ટાળી લાલચમાં સાસરિયાવાળાએ તેના દીધી. થોડા દિવસ બાદ પીડિતાએ લગ્ન જાણી જોઈને એક નપુંસક યુવક ફરી આ મુદ્દા પર વાત કરી તો સાથે કરાવી દીધા. વિરોધ કરતા તેની સાસરિયાના લોકોએ તેની સાથે ગાળાગાળી શરુ કરી દીધી. મહિલાના જણાવ્યા અનુસાર, સાસરિયાવાળાએ રાવતપુરની રહેવાસી પીડિતાના સ્વીકાર કર્યો કે, તેમને પહેલાથી ખબર હતી અને આ લગ્ન ખાલી દહેજ માટે કર્યા છે.

જયારે મહિલાએ પોતાના પતિની સારવાર કરાવવાની વાત કરી તો સાસરિયાવાળાએ તેની પાસેથી બે લાખ રુપિયા માગ્યા. મહિલાને આશા હતી કે ધીમે ધીમે બધુ સુધરી જશે, એટલા માટે તે ત્યાં જ રહેવા લાગી. આ દરમ્યાન તેના જેઠે તેના પર ખોરી દાનત કરવાનું શરુ કરી દીધું અને તેની છેડતી કરવા લાગ્યો. જ્યારે તેનો વિરોધ કર્યો તે તેની સાથે મારપીટ કરી. મહિલાએ આરોપ લગાવ્યો કે જ્યારે તેના પિયરવાળા સાથે વાતચીત માટે બોલાવ્યા હતા, તો તેમને ફાંસી લગાવવાની વાત કરી, જેથી મામલામાં સમાધાનની જગ્યાએ તેને ખતમ કરી શકાય. પીડિતાની ફરિયાદના આધાર પર પોલીસે પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ કલમ ધારાઓમાં ફરિયાદ નોંધી લીધી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને જરુરી કાર્યવાહી થઈ રહી છે.

## હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

નવી દિલ્હી,

કરવાની કોઈ યોજના નથી. નાણા મંત્રાલયે એક સોગંદનામું દાખલ કર્યું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મળ્યું છે કે, સામાન્ય લોકો ૧૦ અને

સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યં

હતું કે, સુશાસન માટે મને નોબલ

પુરસ્કાર મળવો જોઈએ. એલજીએ

સિક્કાઓને સામાન્ય રીતે ઓળખી ટેક્સટાઈટ સુવિધાઓને ફરીથી કેન્દ્ર સરકારે દિલ્હી શકાય તેવા બનાવવાની માંગ હાઈકોર્ટમાં માહિતી આપી હતી કે, કરવામાં આવી હતી.દિલ્હી હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં, અરજદારે દાવો કર્યો છે કે, તેમણે ચલણ ડિઝાઇનમાં હાજર ખામીઓનો છે, જેમાં જણાવાયું છે કે, ૨૦૨૨માં અભ્યાસ કર્યો છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે, ૫૦ રૂપિયાની નોટ અન્ય કરવામાં આવેલા સર્વેમાં જાણવા નોટોથી સ્પષ્ટ રીતે અલગ નથી. તે જ સમયે, નાણા મંત્રાલયે એ પણ ૨૦ ના સિક્કા કરતાં નોટો વધુ પસંદ સ્વીકાર્યું કે, ૧૦, ૨૦ અને ૫૦ ની કરે છે.આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં મહાત્મા ગાંધી નોટોની નવી શ્રેણીમાં એક ૅંન્ની સુનાવણી દરમિયાન કોણીય બ્લીડ લાઇન અને ઉપશેલી પ્રકાશમાં આવ્યો હતો. જે રોહિત પ્રિન્ટ જેવી ટેક્સટાઈટ સુવિધાઓ નામના અરજદાર દ્વારા દાખલ નથી.આ નોટો વધુ પડતી હેન્ડલિંગને કરવામાં આવી હતી. અરજીમાં કારણે, આ સુવિધાઓ ઝડપથી ઘસાઈ દષ્ટિહીન નાગરિકો માટે ૫૦ અને જાય છે. દિલ્હી હાઈકોર્ટમાં નાણા તેનાથી નીચેના મૂલ્યની નોટો અને મંત્રાલયે જણાવ્યું હતું કે, આ બનાવશે.

સુશાસન માટે મને નોબલ પુરસ્કાર મળવો જોઇએ નવી દિલ્હી, કેજરીવાલે પોતાના બે સાથી મિત્રો નેતા બનવા સુધીની વાર્તા સંભળાવી

નેતા જાસમીન શાહના પુસ્તક

કેજરીવાલ મૉડલને પંજાબી ભાષામાં

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ

અમલમાં મૂકવાથી ઉત્પાદન ખર્ચ અને કાર્યક્ષમતા પર મોટી અસર પડશે. નાણા મંત્રાલયે કહ્યું હતું કે, નવી મહાત્મા ગાંધી શ્રેણીની દરેક નોટનું કદ અલગ હોવા છતાં, દષ્ટિહીન લોકો તેમને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. મંત્રાલયે એ પણ સ્વીકાર્યું હતું કે, મહાત્મા ગાંધીનો ફોટો વાળી નોટો એક સાથે ચલણમાં હોવાથી ઓળખવામાં મુશ્કેલી પડી શકે છે. નાણા મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, જૂની શ્રેણીની નોટો જેમ જેમ ચલણમાંથી બહાર થઈ જાય છે. તેથી નવી શ્રેણીના લક્ષણો વિકલાંગ લોકો માટે ઓળખને અત્યંત સરળ

હતી. દિલ્હીમાં પોતાની સરકાર દ્વારા

કરવામાં આવેલા કામકાજનો પણ

ઉલ્લેખ કર્યો હતો. તેમણે શિક્ષણ અને

સ્વાસ્થ્ય ક્ષેત્રે પોતાની સરકારમાં

થયેલા કામકાજના વખાણ કર્યા હતાં.

ઉલ્લેખનીય છે, અમેરિકાના પ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના માટે નોબલ

મેગ્સેસે એવોર્ડ જીતનારા અરવિંદ

કેજરીવાલે પોતાના માટે નોબલ

પુરસ્કારની માગ કરી છે. તેમણે કહ્યું

કે, જેટલા દિવસ અમારી સરકાર

આરટીઆઈ કાર્યકર તરીકે

પ્રાઈઝની માગ કરી છે.

## પુલવામા એટેક માટે વિસ્ફોટકો એમેઝોન પરથી ખરીદવામાં આવ્યા હતાઃ રિપોર્ટ

એમેઝોન પરથી ખરીદવામાં આવ્યા સંસ્થાઓને અપાતા ફન્ડિંગ પર નજર આતંકવાદીઓને ઓનલાઈન મની ટ્રાન્સફર પ્લેટફોર્મ 'પે-પલ' દ્વારા પૈસા આપ્યા હતા. આ બંને મામલાને

હુ મલામાં ઉપયોગમાં લેવાયેલા સર્વિસ જો ખોટા હાથમાં જર્શે તો એ વિસ્ફોટક પદાર્થો ઇ-કોમર્સ વેબસાઇટ આતંકવાદના ઝડપી પ્રસારનું માધ્યમ

૨૦૧૯માં થયેલા આતંકવાદી કોમર્સઅને ડિઝિટલ મની ટ્રાન્સફર હોતી નથી, પરંતુ અલગ-અલગ જગ્યાઓ માધ્યમો જેવા ઓનલાઈન પેમેન્ટ, ફાયનાન્શિયલ સિસ્ટમનો ઉપયોગ ગેમિંગ પ્લેટફોર્મ્સ, સોશ્યલ મીડિયા પોતાની ગતિવિધિઓને ચાલું રાખવા અને ઈ-કોમર્સ સાઇટ્સનો ઉપયોગ અને હુમલો કરવા માટે કરે છે.

ઉદાહરણ તરીકે રજૂ કરીને કરી રહ્યા છે. આતંકવાદ સંબંધિત જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એફએટીએફે ચેતવણી આપી છે કે ઇ- ફન્ડિંગની રણનીતિઓ એક જેવી

આતંકવાદના ઝડપી પ્રસારનું માધ્યમ પરિસ્થિતિઓના હિસાબથી અલગ બની શકે છે. એફએટીએફની આ રીતો અપનાવવામાં આવે છે. ઘણા હતા. વિશ્વભરમાં આતંકવાદી રિપોર્ટનું નામ - 'કોમ્પ્રિહેન્સિવ દેશોમાં આતંકવાદના ફન્ડિંગને અપડેટ ઓન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ સમજવા અને રોકવાની ક્ષમતામાં રાખનાર ફાયનાન્સિયલ એક્શન રિસ્ક' છે. આ રિપોર્ટના પેજ નંબર હજુ પણ મોટી ખામીઓ છે, અને જો ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પોતાના ૧૩૧ પર ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે તેને સમયસર બરાબર કરવામાં નહીં રિપોર્ટમાં આ દાવો કર્યો છે. જેમાં આતંકવાદના ફન્ડિંગની પદ્ધતિ આવેતો આતંકવાદી સંગઠનો વર્તમાન જણાવાયું છે કે ૨૦૨૨માં યુપીના બદલાઈ છે. આ રિપોર્ટ અનુસાર, ખામીઓનો ફાયદો ઉઠાવતા રહેશે. ગોરખપુરમાં ગોરખનાથ મંદિર પર આતંકવાદી સંગઠનો હવે પરંપરાગત આ રિપોર્ટ અનુસાર, કેવી રીતે હુમલામાં સામેલ ફન્ડિંગ માધ્યમની સાથે-સાથે ડિઝિટલ આતંકવાદી સંગઠન આંતરરાષ્ટ્રીય

#### અશનિશા ઈન્ડસ્ટ્રીસ લિમીટેડ

CIN: L74110GJ2009PLC057629 રજીસ્ટર્ડ ઓફીસ: ૭મે માળ, અશોકા ચેમ્બસૅ, મીઠાખળી છ રસ્તા, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ashnishalimited@gmail.com, Website : www.ashnisha.ir

૧૬મી વાર્ષિક સામાન્ય સભા ઈ-વોર્ટીંગ માહિતી તથા બુક બંધ થવાની તારીખની નોટિસ ળાધી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેસેના પરિષત્ર નં ૧૪/૨૦૨૦ તા. ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર નં ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૦, પરિપત્ર ન ૦૩/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ , પરિપત્ર ન ૦૯/૨૦૨૩ તા. ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩ અને પરિપત્ર ન ૦૯/૨૦૨૪ તા. ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૪ (એમ.સી.એ. પરિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના પરિપત્ર નં SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર ન SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩, પરિપત્ર નં SEBI/HO/CFD/CFD PoD-2/P/CIR/2023/167 તા. ૭૧ી ઑક્ટોબર, ૨૦૨૩ અને SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 તા. ૩જી ઑક્ટોબર, ૨૦૨૪ (સેબી પરિપત્ર) અને અન્ય તમામ સંબંધિત પરિપત્રો સમયાંતરે જારી કરવામાં આવેલ છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સલ્યોની વાર્ષિક સામાન્ય સભા (એ.જ.એમ.) તા. ૧૨મી. ઓગ્સ્ટ, ૧૦૧૫. મંગળવારના રોજ બપોરે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ (વી.સી.) અન્ય ઓડિયો વિઝયુલ માધ્યમ (ઓ.એ.વી.એમ.) દ્વારા યોજાશે, જેમા એ.જી.એમ. નોટિસમા દર્શોવામાં આવ્યા મુજબના બિઝનેસ હાથ ધરાશે.

કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૯૧ તથા સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથા શેર ડ્રાન્સક બુક ૭મી ઓગ્સ્ટ, ૨૦૨૫ થી ૧૨મી, ઓગ્સ્ટ, ૨૦૨૫ સુધી બંધ રહેશે. ( બંને દિવસો સહિત) એમ.સી.એ. પરિપત્રો તથા સેબી પરિપત્રોને ધ્યાનમાં રાખીને કંપનીની વાર્ષિક સામાન્ય સભાની જાણ કરતી નોટિસ તથા નાણાકિય વર્ષે ૨૦૨૪ -૨૫ માટેનો વાર્ષિક અહેવાલ, ઈલેકટ્રોનિક માધ્યમથી જે સભ્યોના ઈમેઈલ આઈડી કંપની તથા રજિસ્ટાર અને શેર ટાન્સકર એજન્ટ તથા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોધાયેલા છે તેમને મોકલવામાં આવ

કંપનીઝ એક્ટ, ર૦૧૩ની કલમ ૧૦૮, કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) અમેન્ડમેન્ટ ફલ્સ, ર૦૧૫ના નિયમ ર૦ અને સેબી (**લિસ્ટીંગ ઓ**બ્લોગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમેન્ટમ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશન ૪૪ અન્વયે કંપની એ.જી.એમ.ની નોટીસમાં દર્શાવેલા કામકાજ અંગે વાર્ષિક સામાન્ય સભામાં ઈલેકટ્રોનિક માધ્યમથી મત આપી શકે તે માટે સભ્યોને સી.ડી.એસ.એલ. ના માધ્યમથી રીમોટ ઈ-વોટીંગની સુવિધા પુરી પાડે છે. સભ્યોને મોકલવામાં આવેલી એ.જી.એમ.ની નોટીસમાં રીમોટ ઈ-વોટીંગ અંગે વિસ્તૃત સૂચના

માપવામાં આવી છે.કંપનીઝ એક્ટ, ૨૦૧૩ અન્વયે પૂરી પાડવામાં આવતી વિગતો તથા નિયમો નીચેમુજબ છે : રીમોટ ઈ-વોર્ટીંગ માટેની કટ ઓક ડેટ દઠી ઓગ્સ્ટ. ૨૦૨૫ છે. ઈ-વોટીંગની સમયમર્યાદાંદ ઈ-વોટીંગ દમી ઓગ્સ્ટ, ૨૦૨૫ ના સવારે ૯:૦૦ કલાકે સરૂ થશે અને ૧૧મી ઓગ્સ્ટ, ૨૦૨૫ ના સાંજે પ:૦૦ કલાકે પૂર્ણ થશે. . જો કોઈ વ્યક્તિ એ.જી.એમ.ની નોટીસ મોકલ્યા બાદ શેર હસ્તગત કરે અને કંપનીના સભ્ય બને તથા ૬ઠી ઓગ્સ્ટ, ૨૦૨૫ ની ક્ર્ટ ઓફ તારીખ સુધીમાં શેર ધરાવતા હોય, તો તે

એ જી.એમ.ની નોટીસમાં દરાવિલી રીમોટ ઈ-વોટીગની સુચના અને પ્રક્રિયા અનુસરીને તેમનો મત આપી શકે છે. જે વ્યક્તિનું નામ ક્ર્ટ ઓફ તારીખ સુધીમાં સભ્યોના રજિસ્ટરમાં હોય અથવા ડીપોઝીટરીઝ દ્વારા જળવવામાં આવતા બેનીફીશીયલ ઓનર્સના રજિસ્ટરમાં હોય, તે જ એ.જી.એમ.માં મ

આપવા તથા રીમોટ ઈ-વોર્ટીગની સુવિધાનો ઉપયોગ કરવા હકદાર રહેશે, તેમ છતાં, જો કોઈ વ્યક્તિ પહેલાથી જ **સી.ડી.એસ.એલ.**માં રીમોટ ઈ-વોર્ટીગ માટે નોંધાયેલી હોય, તો વર્તમાન જો સભ્યો વી.સી. / ઓ.એ.વી.એમ. સુવિધા દ્વારા એ.જી.એમ.માં ભાગ લેતા હોય અને જેમણે રીમોટ ઈવોટીંગ દ્વારા મત ન આપ્યો હોય, તે સભ્યો એ.જી.એમ.માં ઈવોટીંગ દ્વારા મત

સભ્યો રીમોટ ઈવોટીંગ દ્વારા મત આપ્યા બાદ પણ એ.જી.એમ.માં વી.સી. / ઓ.એ.વી.એમ. સુવિધા દ્વારા ભાગ લઈ શકશે, પરંતુ એ.જી.એમ.માં કરી મત નહી આપી શકે ઈવોટીંગ કરવાની, વી.સી. / ઓ.એ.વી.એમ. સુવિધા દ્વારા એ.જી.એમ.માં ભાગ લેવાની તથા શેરહોલ્ડસે દ્વારા ઈમેઈલ આઈડી નોંધવાની પ્રક્રિયા એ.જી.એમ.ની નોટિસમાં આપવામાં આવેલ છે. એ.જી.એમ.ની નોટિસ, કંપનીની વેબસાઈટ www.ashnisha.in સી.ડી.એસ.એલ.ની વેબસાઈટ www.evotingindia.com અને બી.એસ.ઈ.ની વેબસાઈટ

www.bseindia.com પર ઊપલબ્ધ છે.

. ઈ-વોટીંગને લગતો કોઈ પ્રશ્ન હોય તો સભ્યો / બેનીફીશીયલ ઓનર્સ helpdesk.evoting@cdslindia.com પર ઈ-મેઈલ કરી શકે છે અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૧ ૦૯૯૧૧

અશનિશા ઈન્ડસ્ટીસ લિમીટેડ બોડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી

તારીખ : ૧૮.૦૭.૨૦૨૫

મેનેજીંગ ડીરેક્ટર

#### mahindra Home Finance

કોર્પોરેટ ઓફિસ : યુનિટ નં. ૨૦૩, અમીટી બિલ્ડીંગ, અગ્સ્તયા કોમ્પલેક્ષ, કોર્પોરેટ પાર્ક કામાની જંકશન ફાયર સ્ટેશન સામે, એલ.બી.એસ માર્ગ, કામાની કુર્લા વેસ્ટ મુંબઈ-૪૦૦૦૭૦ રિજનલ ઓફિસ : મહીન્દ્રા ટાવર, પી.કે કુર્ને ચોક, વર્લી, મુંબઈ, મહારાષ્ટ્ર-૪૦૦૦૧૮. | CIN - U65922MH2007PLC169791

આથી અમે જણાવીએ છીએ. તા.૧૮.૧૦.૨૦૨૫ થી નીચેની શાખાઓના સ્થળાંતરની સચના આપીએ છીએ.

નીચેની શાખાઓનું સ્થળાતંર		
SHIFTING BRANCH ADDRESS (FROM)	SHIFTING BRANCH ADDRESS (TO)	
હિંમતનગર : પહેલો માળ, વ્રજ કોમ્પલેક્ષ, ટાઉન હોલ પાસે,	પહેલો માળ, દુકાન નં. પ૩, વન વર્લ્ડ, પોલીટેકનીક કોલેજ ચાર રસ્તા,	
પ્રતાપગઢ સામે, પેટ્રોલ પંપ, હિંમતનગર, ગુજરાત-૩૮૩૦૦૧.	શામળાજી હાઈવે, મોતીપુરા, હિંમતનગર- ૩૮૩૦૦૧.	
<b>નડીચાદ</b> ∶૨૦૧-૨૦૩, શીવ પોઈન્ટ, બીજો માળ, દેસાઈ પાર્ક	દુકાન નં. ૧૦૫, પહેલો માળ, પેટલાદ રોડ, નડીયાદ,	
સોસાયટી સામે, કોલેજ રોડ, નડીયાદ, ગુજરાત ૩૮૭૦૦૧.	ખેડા, ગુજરાત - ૩૮૭૦૦૧	
થરાદ : પહેલો માળ, બીએસએનએલ ઓફિસ સામે, તાલુકા	પહેલો માળ, બીએસએનએલ ઓફિસ સામે, તાલુકા	
પંચાયત પાસે, પોલીસ સ્ટેશન રોડ, થરાદ, ગુજરાત-૩૮૫૫૬૫	પંચાયત પાસે, પોલીસ સ્ટેશન રોડ, થરાદ, ગુજરાત-૩૮૫૫૬૫	
	जीटोनी शाणाट SHIFTING BRANCH ADDRESS (FROM) હિંમતનગર : પહેલો માળ, ત્રજ કોમ્પલેક્ષ, ટાઉન હોલ પાસે, પ્રતાપગઢ સામે, પેટ્રોલ પંપ, હિંમતનગર, ગુજરાત-૩૮૩૦૦૧. जડીચાદ :૨૦૧-૨૦૩, શીવ પોઈન્ટ, બીજો માળ, દેસાઈ પાર્ક સોસાયટી સામે, કોલેજ રોડ, નડીયાદ, ગુજરાત ૩૮૭૦૦૧. થરાદ : પહેલો માળ, બીએસએનએલ ઓફિસ સામે, તાલુકા	

Belapur, Navi Mumbai — 400614. GN: 165923MH2008PLC261472. ધ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002ની કલમ 13 (2) હેઠળ જ્યારે નીચે સહી કરાયેલી વ્યક્તિઓમાં સિક્યુરિટીઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002 હેઠળ મેસર્સ સુર્યોદ્ય સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ ("એસએસએફબીએલ")ના અધિકૃત અધિકારી છે અને સુરક્ષા હિત (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ 2002ના નિયમ 3 સાથે વાંચવામાં આવતી કલમ 13(12) હેઠળ પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ઉપરોક્ત કાયદાની કલમ 13(2) હેઠળ ડિમાન્ડ નીટિસ ફટકારવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ઉપરોક્ત કાયદાની કલમ 13(2) હેઠળ ડિમાન્ડ નીટિસ ફટકારવામાં આવેલી સ્તાનો એન્ટ અણલેનાર(એ), એર્ફેન્ટર(ઓ)ને સંબંધિત નીટિસ જારી થયાની તારીખથી 60 દિવસની અંદર અદાતન વ્યાજ, ખર્ચ અને ચાર્જિસ સહિત સંપૂર્ણ બાકી નીકળતી રકમની ચૂકવણી કરીને અને નીચે આપેલી નોટિસને તમારા પર વૈકલ્પિક સેવાના માર્ગ તરીકે અને તેના પ્રકાશન દ્વારા કંપનીને તેમની સંપૂર્ણ જવાબદારી અદા કરવા અપીલ કરવી. લોનની યોગ્ય ચુકવણી માટેની જામીનગીરી તરીકે, નીચેની સિક્યોર્ડ એસેટ (ઓ) અનુક્રમે ઉપરોક્ત ઋણલેનાર (ઓ), ગેફન્ટર (ઓ) ડારેન્ટર (ઓ) સાક્રમો અનેસેસએસએફબીએલને ગીરવે મૂકવામાં આવી છે.

1. શ્રી હુસ્નુમિયા શેખ સ/ઓ ગુલામ મોહમ્મદ શેખ. 2. શ્રીમતી અક્સાબીબી શેખ ડબલ્ય/ઓ	- <b>ઋણલેનાર/ ગેરેન્ટરનું નામ તારીખ ઓફ ડિમાન્ડ નોટિસ</b> ૧૩.૦૬.૨૦૨૫	<b>કણલેનાર/ સહ-ઋણલેનાર/ ગેરેન્ટરનું નામ</b> તારીખ ઓફ ડિમાન્ડ નોટિસ	
શેખ. 2. શ્રીમતી અક્સાબીબી શેખ ડબલ્ય/ઓ			
	અક્સાબીબી શેખ ડબલ્યુ/ઓ શ્રી મોહમદમીન અનવરભાઈ <b>કુલ બાકી રકમ</b> રોજ રૂ	શેખ, 2. શ્રીમતી અક્સાબીબી શેખ ડબલ્યુ/ઓ શેખ હુસુમિયા, 3. શ્રી મોહમદમીન અનવરભાઈ	

જમીન નો પ્લોટ, મોર્જ દિવાળીપુરા, વડોદરા, જૂનો સર્વે નં. 254, બ્લોક/સર્વે નં. 172 પાયકો, 8144.50 ચોરસ મીટર, સી. એસ. નં. 172 પાયકી/9, "આરઝુ બંગલા" તરીકે ઓળખાય છે, પ્લોટ/બ્લોક નં. M/14, 47.06 ચોરસ મીટર પ્લોટ, રોડ અને સીએમઓન પ્લોટનો અવિભાજિત હિસ્સો, 45.34 ચોરસ મીટર માપવા, કુલ 92.40 ચોરસ મીટર, બાંધકામ 55.38 ચોરસ મીટર માપવા, નોંધણી જિલ્લો વડોદર અને પેટા જિલ્લો વડોદરા અને જિલ્લો વડોદરા, ચતુઃ સીમા - પૂર્વઃ બ્લોક નં. ૧૭૨ પાઈકીની જમીન પશ્ચિમઃ ૯ મીટર, રોડ, ઉત્તરઃ પ્લોટ નં. A-૧૩ ની જમીન, દક્ષિણઃ પ્લોટ નં. A-૧૫ ની જમીન

227040001382 and 227060001383 1. શ્રી પટેલ કેતનકુમાર ફુલચંદભાઈ સ/ઓ ફુલચંદ ગંગારામ પટેલ, 2. શ્રીમતી નેહલબેન કેતનકુમાર પટેલ ડબ્લ્યુ/ઓ પટેલ કેતનકુમાર	તારાખ આફ ાડમાન્ડ નાાટસ	૧૩.૦૬.૨૦૨૫
	એનપીએની તારીખ	૦૮.૦૬.૨૦૨૫
	કુલ બાકી રકમ	૦૯.૦૬.૨૦૨૫ ના રોજ રૂ. ૪૪,૪૪,૮૭૨.૩૭/-
<b>ઝિલ્ટા) દુ ગુનું ગુનું પ્રિયાવર પ્રિલંશન (આ)મનું વાર્શન</b> . નમાંમ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર		

**સિંક્યોર્ડ એસેટ(ઓ)/સ્થાવર મિલકત (ઓ)નું વર્ણન** : તમામ ભાગ અને ાહરસા સાથ ના સ્થાવર રહેણાંક મિલકત, આર. એસ. નં. ૧૪/૨ પાયકી, બાંધેલું મકાન, પ્લોટ નં. દ્ પાયકી દક્ષિણ બાજુ, કુલ ૩૧૭.૭૧ ચોર્સ મીટર, બિલ્ટ અપ્ એરિયા ૮૧.૩૦ ચોરસ મીટર, મૌજે હિંમતનગર મોતીપુર, તાલુકો હિંમતનગર્, જિલ્લો સાબુરકાંઠા, નોંધણી પેટા જિલ્લો હિંમતનગર જિલ્લો. ચતુઃ સીમા - ઉત્તર: યોજન મુજબ પ્લોટ નં. 6 પાઈકી રહેઠાણ જમીન, દક્ષિણ: યોજના મુજબ પ્લોટ નં. 7, પૂર્વ: યોજના મુજબ રોડ, પ્લોટ નં. 16, પશ્ચિમ: યોજના મુજબ પ્લોટ નં. 2.

અધિકૃત અધિકારી, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ

#### KIFS હાઉસીંગ કાઈનાન્સ લિમીટેડ

સ્થળ: ગુજરાત, તારીખ: ૧૯.૦૭.૨૦૨૫

**રજીસ્ટર્ડ ઓફ્સિ**ઃ છુક્કો માળ, KIFS કોર્પોરેટ હાઉસ, હોટલ પ્લાનેટ લેન્ડમાર્કની બાજુમાં, અશોક વાટીકાની પાસે, BRTS, ઈસ્કોન - આંબલી રોડ, બોડકદેવ, આંબલી, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૫૪ **કોર્પોરેટ ઓફિસ**ઃ સી-૯૦૨, લોટસ પાર્ક, ગ્રેહમ ફર્થ કર્મ્પાઉન્ડ, વેસ્ટેન એક્ષ્પ્રેસ હાઈવે, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૬૩, મહારાષ્ટ્ર, ઈન્ડિયા, **કોન નં.** + ૯૧ ૨૨ ૬૧૭૬૬૪૦૦, ઈમેલ : contact@kifshoi Website: www.kifshousing.com, CIN,: U65922GJ2015PLC085079, RBI COR: DOR-00145

<mark>પરિશિષ્ટ-૪ સાંકેતિક પ્રત્રેશન નોટીસ (સ્થાવર મિલકતો માટે)</mark> આથી, **KIFS હાઉસીંગ કાઇનાન્સ હિમીટેક** ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ તથા કલમ ૧૩(૨) હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફ્રોર્સમેન્ટ) નિયમો, રૂ૦૦૨ તથા નિયમ ૩ અંતર્ગત કંપનીના ઉધારકર્તાઓ/જામીનદારોની માંગણા નોટીસ જારી કરીને નોટીસ મળ્યાની તારીખથી eo દિવસોની અંદર બાકી રકમ ભરી જવા જણાવેલ હતું. ઉધારકર્તા ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા અને જાહેર જનતા નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ ૧૩ની પેટા કલમ (૪) હેઠળ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ ૨૦૦૨ના રૂલ ૮ સાથે મળેલી સત્તાની રૂઅ અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ મિલકતોનો કબજો લઇ લીધેલ છે. ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહ મિલકતો અંગ કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર KIFS **હાઉસીંગ ફાઇ**લ **લિમીટેડ** ની રકમ અને વ્યાજ બોજાને આધીન રહેશે.

IGH	<b>3માટડ</b> ના રકમ અને વ્યાજ બાજાને આયાન રહેશે.			
ક્રમ નં.	ઉધારકર્તા/સહ-ઉધારકર્તા/ જામીનદારોનું નામ અને એનપીએ ની તારીખ	ડીમાન્ડ નોટીસની તારીખ, બાકી લ્હેંણી સ્કમ / શાખા LAN	મુક્સ્ટ મિલક્તોનું વર્ણન	અને પ્રકાર વારીખ પઝેશનની
	(૧). જલુ માનશીભાઈ જીલુભાઇ (અરજદાર), (૨). કમળાબેન માનશીભાઇ જલુ (સલ-અરજદાર-૧) NPA:10.04.2025	ડીમાન્ડ નોટીસની તા : ૦૯.૦૫.૨૦૨૫ 0/s રૂા. ૮,૩૦,૦૮७/-	હાઉસ નં. ૩૩૩, પ્રાથમીક સ્કુલની પાસે, ગામ - કરાડી, તાલુકો- સાયલા, જીલ્લો-સુરેન્દ્રનગર, ગુજરાત, ઈન્ડિયા - ૩૬૩૪૪૦. ચતુ:સીમા (સેલ કીડ મુજબ) :- પૂર્વે: વાસ્કુરભાઈ જલુ, પશ્ચિમે: જલુભાઈનો ખુલ્લો પ્લીટ, ઉત્તરે: રોડ અને આપાભાઈ કાલભાઈ	૧૫.૦७.૨૦૨૫
۹.		RAJKOT / 28772 / LNHLRKT016722	વેગંડ, દક્ષિણે : મગલુભાઈનો ખુલ્લો પ્લોટ. ચતુઃસીમા (સાઇટ મુજછ) :- પૂર્વેન : વાસ્કુરભાઈ જલુ, પશ્ચિમેન્વ : જલુભાઈનો ખુલ્લો પ્લોટ, ઉત્તરેન્વ : રોડ અને આપાભાઈ કાલભાઈ વેગડ, દક્ષિણેન્વ: મગલુભાઈનો ખુલ્લો પ્લોટ.	(सांडेतिङ)
ર.	(૧). હિતેન્દ્રભાઈ ગોમનભાઈ પરમાર (અરજદાર), (૨). ગોમનભાઈ રમાભાઈ પરમાર (સહ-અરજદાર- ૧), (૩). ચંચલબેન ગોમનભાઈ પરમાર (સહ-અરજદાર-૧) NPA: 10.04.2025	ડીમાન્ડ નોટીસની તા : ૦૯.૦૫.૨૦૨૫ 0/s રૂા. ૫,૯૦,૯૫૫/- શાગા / LAN - ANKLESHWAR / 4279 / LNHLANK009785	મિલકત નં. ૨૪૫, નવી વસાહત, ભાડકોદરા, અંકલેશ્વર - ભરૂચ, પરમાર કળીયા ની પાસે, ભરૂચ, ગુજરાત, ઈન્ડિયા, લેન્ડમાર્ક - ભરૂચ, અંકલેશ્વર, ગુજરાત - ૩૯૩૦૦૧. <b>ચતુઃસીમા</b> (સેલ કીક મુજબ): - પૂર્વે: રાધે રેસીડેન્સી, પશ્ચિમે: સોસાયટી રોડ, ઉત્તરે: દલપતભાઈ છીપાભાઈ પરમારની મિલકત, દક્ષિણે: રામજીભાઈ ગોમનભાઈનું ઘર. <b>ચતુઃસીમા (સાઈટ મુજબ):</b> - પૂર્વે-૧: જોડેની મિલકત, પશ્ચિમેન: સોસાયટી રોડ, ઉત્તરે-૧: જોડેનો પ્લોટ, દક્ષિણેન: જોડેનો પ્લોટ.	૧૫.૦૯.૨૦૨૫ (સાંકેતિક)
3.	(૧). કલ્પેશ વિનોદ બરક (અરજદાર), (૨). બરક વિશાખાબેન કલ્પેશભાર્ઇ (સહ-અરજદાર-૧) NPA:10.04.2025	Shios নাইনিকা বা : ০৫.০૫.২০২૫ 0/s হ্বা. ૫,૮৭,୨૮७.୨ হাদো / LAN - SURENDRANAGAR / 20566 / LNHESND014156	પ્લોટ નં. ૧૫૧ પૈકી, દક્ષિણ બાજુની જમીન ૫૦-૦૦ સ્કે. મી., ખાસરા નં. ૪૨૪/૧, ગેટ નં. ૪, આનંદધામ ટાઉનશીપ, ગેટ નં. ૦૪, ગઢડા રોડ, બોટાદ સીટી, ગુજરાત-૩૨૪૭૧૦. <b>ચા</b> દ્યાં સીમ (સેલ ડીડ મુજબ): પૂર્વે: લાગુ પ્લોટ નં. ૧૪૬, પશ્ચિમે: લાગુ ૧.૦૦ મી. રોડ, ઉત્તરે: લાગુ જમીનનો બાકી પ્લોટ, દક્ષિણો: લાગુ પ્લોટ નં. ૧૫૦. ચતુઃસીમાં (સાઇટ મુજબ):- પૂર્વે-૧: લાગુ પ્લોટ નં. ૧૪૬, પશ્ચિમેન: લાગુ ૬.૦૦ મી. રોડ, ઉત્તરે-૧: લાગુ જમીનનો બાકી પ્લોટ, દક્ષિણો-૧: લાગુ પ્લોટ નં. ૧૫૦.	૧૫.૦७.૨૦૨૫ (સાંકેતિક)
ъ.	(૧). કલ્પેશ વિનોદ બરડ (અરજદાર), (૨). વિશાખાબેન કલ્પેશભાઈ બરડ (સઉ-અરજદાર-૧) NPA:10.04.2025	ડીમાન્ડ નોટીસની বা : ০६.০૫.૨૦૨૫ 0/s হা. ८,४६,७५૫/- शामा / LAN - AHMEDABAD / 1043735 / LNHLB0T006362	પ્લોટ નં. ૧૫૧ પૈકી, દક્ષિણ બાજુની જમીન ૫૦-૦૦ સ્કે. મી., ખાસરા નં. ૪૨૪/૧, ગેટ નં. ૪, આનંદધામ ટાઉનશીપ, ગેટ નં. ૦૪, ગઢડા રોડ, બોટાદ સીટી, ગુજરાત-૩૬૪૭૧૦. <b>ચતુઃસીમાં</b> ( <b>સેલ કોક મુજબ): પૂર્વે</b> : લાગુ પ્લોટ નં. ૧૪૬, પ <b>ક્ષિમે</b> ં લાગુ ૬.૦૦ મી. રોડ, ઉત્તરે: લાગુ જમીનનો બાકી પ્લોટ, દક્ષિણે: લાગુ પ્લોટ નં. ૧૫૦. ચતુઃસીમા (સાઇટ મુજબ):- પૂર્વે-૧: લાગુ પ્લોટ નં. ૧૧૬, પશ્ચિમે-૧: લાગુ ૬.૦૦ મી. રોડ, ઉત્તરે-૧: લાગુ જમીનનો બાકી પ્લોટ, દક્ષિણે-૧: લાગુ પ્લોટ નં. ૧૫૦.	૧૫.૦७.૨૦૨૫ (સાંકેતિક)
ų.	(૧). વિષ્ણુભાઈ મથુરભાઈ ચોલચા (અરજદાર), (૨). તમન્ગાબિન કોળી (સલ-અરજદાર-૧) NPA : 10.02.2025	Shiros লাগ্রীরালী বা : ০৫.০૫.২০২૫ 0/s হা. ८,८૫,०৭3/- शामा / LAN - ANKLESHWAR / 5755 / LNHEANK010406	૧૨૨, નવા ફળીયું, ચુંધેલી, બસ સ્ટેન્ડની પાસે, ચુંધેલી, છોટાઉદેપુર, ગુજરાત - ૩૯૧૧૪૦, બસ સ્ટેન્ડની પાસે, વડોદરા, ગુજરાત, ઈન્ડિયા - ૩૯૧૧૪૦. ચતુ:સીમા (સેલ ડીક મુજબ): પૂર્વે : ચતુરભાઈ બીખાભાઈ કોળીનું ઘર, પશ્ચિમે : વિકલભાઈ છગનભાઈનું ઘર, ઉત્તરે : આંતરીક રોડ, દક્ષિણે : ભરતભાઈ નારાણભાઈનું ઘર ચતુ:સીમા (સાઈટ મુજબ): - પૂર્વેન : ચતુરભાઈ બીખાભાઈ કોળીનું ઘર, પશ્ચિમે-૧ : વિકલભાઈ છગનભાઈનું ઘર, ઉત્તરે-૧ : આંતરીક રોડ, દક્ષિણે-૧: ભરતભાઈનારાણભાઈનું ઘર.	૧૫.૦ <b>૭.૨૦૨૫</b> (સાંકેતિક)

**ઉદાાસ્કતાઓ / જામીનદારોને કાળુની બોટીસ** ઉધારકર્તા/જામીનદારોને આથી ચેતવણી આપવામાં આવે છે કે મિલકત અહીં પછી કોઈપણ સમયે જાહેર હરાજ/ટેન્ડર દ્વારા વેચી શકાય છે અને તેથી તેને સિકયોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ - ૨૦૦૨ ના નિયમ ૬, ૮ અને ૯ હેઠળ નોટીસ તરીકે પણ ગણવામાં આવી શકે છે વિગતવાર ઈન્વેન્ટરી અને પંચનામા અવરોધોને કારણે રેકોર્ડ કરી શકયાં નથી કારણ કે આવી મિલકતનો કોટોગ્રાફ લેવામાં આવ્યા છે.

અધિકૃત અધિકારી, KIFS હાઉસીંગ ફાઈનાન્સ લિમીટે ારીખ : ૧૯.૦७.૨૦૨૫, સ્થળ : ગુજરાત

## અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા ઈશ્વરકૃપા સેવા ગ્રુપના સહયોગથી હેલ્પએજ ઇન્ડિયાનું આયોજન

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય માટે ભારત રત્નની માગ કરી હતી.

અટકાવ્યા હોવા છતાં મેં જેટલુ કામ લોન્ચ કરવામાં આવ્યું છે. પંજાબના

કર્યું છે, તેને ધ્યાનમાં લેતાં શાસન મોહાલીમાં સ્થિત કલકટ ભવનમાં

અને વહીવટી તંત્ર માટે મને નોબલ આયોજિત કાર્યક્રમમાં કેજરીવાલે

પુરસ્કાર મળવો જોઈએ. અગાઉ પણ પોતાની એક સામાન્ય કર્મચારીથી

અમદાવાદ, વૃદ્ધાવસ્થામાં થતા માનસિક આરોગ્યના પ્રશ્ના અંગે જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અનુભવી ડૉક્ટર નરસિંહ ચૌધરી, સાયકોલોજીસ્ટ દ્વારા ચર્ચા તથા માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવશે. જે જીવનમાં ખૂબ ઉપયોગી થશે, જેથી વરિષ્ઠ ભાઈ- બહેનોએ અચૂક લાભ લેવા વિનંતી છે.

આ કાર્યક્રમ ૨૦મી, જુલાઈ, ૨૦૨૫ એટલે આજે (રવિવાર)સમય : બપોરે ૩.૦૦ ક્લાક થી શરૂ થશે, કાર્યક્રમ શુભ સ્થળઃ ગાયત્રી ચેતના કેન્દ્ર , ૧લો માળ, મધુવન કોમ્પલેક્ષ, ગોરનો કુવા બસ સ્ટેન્ડ સામે, મણિનગર ( પૂર્વ), અમદાવાદ ખાતે યોજાશે.

### આગામી સમયે તમને સેનિક પુરુષ અથવા સ્ત્રી જોવા મળે તો તેને થેક્ર યુ કહો : પૃથ્વીરાજ સુકુમારન

વાત કરી. "આપણને સામાન્ય કરાવે છે. (૧૯-૮)

પૃથ્વીરાજ જીવન જીવવા મળે છે. કારણ કે સુકુમારન યુનિફોર્મમાં પુરુષો અને અમુક લોક તેમના જાનની બાજી મહિલાઓના રોજબરોજના ત્યાગ લગાવીને દેશની રક્ષણ કરતા હોય અને તેમની સેવાઓ મોટે ભાગે છે." એમ કહીને તે ઉમેરે છે કે ધ્યાન બહાર રહી જાય છે તે વિશે સરઝમી ફક્ત યુનિફોર્મની વાત જણાવે છે. અભિનેતા આગામી નથી. પરંતુ તે શું ભોગ લે છે તેની જિયો હોટસ્ટાર ફિલ્મ સરઝમીમાં વાત છે. ફિલ્મમાં પૃથ્વીરાજ વિજય લશ્કરી અધિકારીની ભૂમિકામાં મેનની ભૂમિકા ભજવી રહ્યો છે, જે જોવા મળશે. તેણે આ ભૂમિકાએ અંગત દુઃખ અને ભાવનાત્મક અંતર દેશની સેવા કરનારાની શાંત સાથે ઝઝૂમતો આદરણીય અધિકારી સહનશીલતામાં ફરી એક વાર છે. બહાદ્દરી પાછળની ડોકિયું કઈ રીતે કરવા મળ્યું તે વિશે મુશ્કેલીઓમાં આ ફિલ્મ ડોકિયું

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad

Editior: Mayur C. Bhatt

એડમિનિસ્ટ્રેશનની અંદર રહીને ઘણા સારા કામો કરવા બદલ નોબલ પુરસ્કાર મળવો જોઈએ. લેફ્ટનન્ટ ગવર્નરે અટકાવ્યો હોવા છતાં મેં દિલ્હીમાં અનેક કામો કર્યા. વધુમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ કામ કરવા માગતા પણ નથી, અને કરવા દેવા પણ. ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલને કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરાયેલા લેફ્ટનન્ટ ગવર્નર દરેક કામમાં અટકાવતાં હતા. કેજરીવાલે આગળ કહ્યું કે, હું એક એવુ મૉડલ બનાવવા માગતો હતો કે, સરકારી શાળા અને હોસ્પિટલ શ્રેષ્ઠ બને. હું કોઈ રાજા નથી. મને ચૂંટણી જીતવાનો પણ શોખ નથી. પણ હું ઈચ્છતો હતો કે, અમે એક મૉડલ તૈયાર કરીએ. એક એવી અપેક્ષા કે, જે આપણા દેશમાં વિસરાઈ ગઈ હતી કે, સરકારી શાળા અને હોસ્પિટલ શ્રેષ્ઠ સેવા આપનારા બની શકે છે. અમે

સેવા અને રસ્તાઓ પણ ઠીક થઈ શકે

છે. અમે તે કરીને બતાવ્યું છે.

રહી, અમને કામ કરતાં અટકાવવામાં આવ્યા હોવા છતાં અમે કામ કર્યું. મને લાગે છે. મને ગવર્નન્સની ઉપર અને લોકોનો માઈન્ડસેટ બદલવા માગતા

હતા કે, પ્રમાણિકતા સાથે કામ કરીએ તો શાળા પણ ઠીક થઈ શકે છે, હોસ્પિટલ પણ ઠીક થઈ શકે છે. વીજ

ઉપરોક્ત શાખામાંથી કામગીરી અસરકારક તારીખ પછી સ્થળાંતરીત કરવામાં આવશે. તમામ ગ્રાહકોએ તેની નોંધ લેવા વિનંતી. અધિકૃત ઓફિસર, મહીન્દ્રા રૂરલ હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડ

#### **Sunil Bharti Mittal Conferred Doctorate** in Business Administration



Ahmedabad, Bharti Enterprises is pleased to announce that it's Founder and Chairman, Mr. Sunil Bharti Mittal, has been awarded an was conferred at the summer University's contribution to global business, entrepreneurship and philanthropy. Mr. Mittal is a pioneer of the Indian telecommunications revolution communications landscape through Bharti Airtel, one of the world's leading telecom companies. His leadership across diverse industries,

infrastructure to financial services and space communications, as also his enduring dedication to ensuring equity in access to education articulate purpose, innovation and global ambition. Speaking on the occasion, Professor Phil Taylor, Vice-Chancellor and President of the University of Bath said, "We are very proud to honour Mr. Sunil Bharti Mittal's considerable achievements in enterprise, Honorary Doctorate in leadership and service to Business Administration by the society. Not only has he built University of Bath, United a world-leading global Kingdom (UK). The honour enterprise but his humanitarian work has impacted the lives of over 3.7 graduation ceremony held at million children through the historic Bath Abbey, in education and rural recognition of Mr. Mittal's development. He sends our graduating students a powerful message of the importance of giving back to society, which we hope will inspire them in their future and has played a pivotal role careers. We are delighted to in shaping the global welcome Mr. Mittal to our alumni community, joining his son and daughter who previously graduated from our School of Management and Faculty of Humanities & Social from telecom and digital Sciences." (13-9)

#### Next time you see a service man or woman, say thank you - Prithviraj Sukumaran Ahmedabad, Premium ton2 of cementitious

Company, with their share of trade volume rising to 41% in Q1 FY26. The Company also achieved a robust trade mix of 76% - the highest in the last 13 quarters. The sustained momentum of the Nuvoco Concreto and Nuvoco Duraguard product portfolio reflects growing recognition as trusted solutions for superior construction needs. The Company's commitment to sustainability is evident as it

products continue to be a materials, down from 457 kg strategic priority for the CO2 per ton in FY24. Commenting on the performance of the Company, Mr. Javakumar Krishnaswamy, Managing Director, Nuvoco Vistas Corp. Ltd., stated, "The Company witnessed healthy volume growth during the quarter. It maintained a sharp focus on premiumisation and trade mix, which contributed to enhanced realizations and led to the highest-ever firstquarter consolidated EBITDA in the Company's history. continues to lead the industry Looking ahead, we remain with the lowest carbon committed to drive sustained emissions, further reducing growth and expand our emissions to 453.8 kg CO2 per market presence. (19-8)

#### **Nuvoco Vistas announces its** financial results for Q1 FY26 Ahmedabad, Nuvoco presence in the Western and

building materials Company in India, announced its financial results for the quarter ended Q3 FY27 post successful Limited (VCL) retaining its fifth strategy of expanding its Cr. (19-10)

Vistas Corp. Ltd., a leading Northern regions. It brings complementary capabilities to enhance geographic reach and create long-term value for June 30, 2025. With 25 stakeholders. The Company MMTPA of combined installed achieved a consolidated cement capacity, the Company is on sales volume of 5.1 MMT in O1 track to achieve approx. 31 FY26. Consolidated revenue MMTPA cement capacity by from operations grew 9% YoY to Rs. 2,873 Cr. in Q1 FY26. The acquisition of Vadraj Cement Company also reported its highest-ever first quarterly largest cement group position consolidated EBITDA of Rs. 533 in India for long term. While Cr. in Q1 FY26. Furthermore, the the Company remains a Company remained committed leading player in East India, to its deleveraging agenda, this acquisition aligns reducing like-for-like<sup>1</sup> net debt seamlessly with Nuvoco's by Rs. 884 Cr. YoY to Rs. 3,474

#### **MICA Launches India's First** School of Applied Creativity



#### WELCOME TO MICA - THE SCHOOL OF IDEAS



step that combines creativity, technology, and education, MICA, formerly (Mudra Institute Communications, Ahmedabad) has launched the School of Applied Creativity, India's stand-alone institution to prepare students with future skills at the cusp of imagination, storytelling, media, and artificial intelligence.

Ahmedabad, In a pioneering

Scheduled to start in July 2026, both programmes will accommodate 80-100 students in their first phase. Mr. Shekhar Kapur, Oscar nominated Filmmaker is part of the faculty as the Chief course available to students and culture. (13-9)

from all over India and the globe. The launch was announced at a conference graced by esteemed dignitaries, including Ms. Tina Ambani (Chairperson, MICA Foundation), Ms. Jaya Deshmukh (Director & CEO, MICA), Mr. Ramkumar Ramamoorthy (Former CMD, Cognizant India and currently Partner, Catalincs), among others. Addressing the gathering, Mrs. Tina Ambani, Chairperson of the MICA Foundation

Communications Research and Education, said, "Since its founding, MICA has always mentor for the institute. The stayed ahead of the curve. We institute will also introduce were among the first to see the online masterclasses in the deep connection between coming few years to make the marketing, communication,

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad. Editior: Mayur C. Bhatt

# Not an 'enemy': How India's ties with Russia reflect the West's past choices



A recent Telegraph article by Tom Sharpe has stirred controversy by branding India an "enemy" over its continued partnership with Russia—a nation blamed for fuelling the and defence cooperation. As a long-time observer of India's strategic calculus, I believe this framing is dangerously simplistic. Rather than vilify India, the West must reckon with how its own historical choices—and geography shaped India's ties with

India's ties with Russia are not born of hostility toward the West, but of historical necessity more than nostalgia. They and geographic logic. During the Cold War, India's non-alignment Russia as a steady supplier and

this time, Meghraja has

created a stir in the entire

Gujarat. After making a ruckus

in the beginning, it took a

break and for the last two

days, Meghraja has been

máking a ruckus again.

However, according to the

weather department's

forecast, there is a possibility

of heavy rain in North and

South Gujarat during the next

24 hours. After that, the

intensity of the rain is likely to

decrease in the state. Winds

may blow at a speed of 30 to

40 kilometers per hour with

thunder in some areas.

Especially after July 17, there

is a possibility of a break in

the rains in the entire state.

The temperature will increase

by 2 to 3 degrees in the state

for the next 2 days and will

decrease again after 2 days.

Banaskantha, Sabarkantha,

Chhota Udepur, Narmada,

Tapi, Dang, Navsari, Valsad,

Daman and Dadra and Nagar

Haveli due to heavy rains today

. However, there is no alert in

hours, from 6 am on Monday

to 6 am on Tuesday, rainfall

has been recorded in 122 talukas of the state. The

highest rainfall was recorded

in Saraswati of Panat (2.8), Dediapada of Narmada (2.6),

Kaprada of Valsad (2.4),

Umarpada of Surat (2.2) and

Khedbrahma of Sabarkantha (2.2). While less than two

inches of rainfall has been recorded in other talukas.

According to the Director of the Meteorological Department

Dr. A. K. Das, due to the fact that three systems are

currently active, rain is falling

in various parts of the state.

A well-marked low pressure

system is active over

northeast Rajasthan, while a

cyclonic circulation is active

over northwest Madhya

Pradesh. Due to these

systems, the rainy conditions

in the state will continue in the

coming days. Rainfall was

recorded in 88 talukas yesterday.

Rainfall was recorded in 88 talukas

of the state from 6 am to 8 pm

yesterday (date-14/07/2025). In

which more than 2 inches of rain

fell in Umarpada of Surat,

Khedbrahya of Sabarkantha and

Kaprada of Valsad. Also, more than

one inch of rain fell in 13 talukas of

40 on high alert signal

25 dams overflow in the state,

So far, 25 dams have

overflowed since the rains started

the state.

Talking about the last 24

the remaining districts.

Yellow alert issued in

masked a tilt towards the Soviet Union, which proved decisive during the 1971 war with Pakistan—a US-backed ally. Soviet support then was not merely symbolic; it was Ukraine war through oil exports strategic, helping India in a conflict that played out more than 4,000 miles from Moscow's borders.

> That partnership matured robust defence cooperation. The 2009 renewal of a Soviet-era agreement, joint projects like the BrahMos cruise missile, and India's \$5.43 billion S-400 Triumf deal in 2018—pursued despite US CAATSA sanctions—reflect represent a calculated hedge:

enter the state on June 16. In Currently, more than 54 percent Sarovar Dam.

a counterweight to China, India's northern adversary.

Sharpe's article fails to engage with this layered history. India's position was not forged in defiance of the West but shaped by the West's Cold War choices and India's need to manage its precarious neighbourhood. Moscow offered what Washington would not: reliable arms without conditionality.

Oil, Ukraine, and West's Reaction Russia's war in Ukraine has sharpened scrutiny of India's neutrality. By May 2025, India was importing 1.96 million barrels of Russian crude daily—roughly 40–44 per cent of its oil supply, a 40 per cent increase since 2022, according

Narmada's Chopadvav Dam overflows Narmada, There is still one 90 percent or more water has water has been stored in 207 day left for the monsoon to been stored in the dams here. dams of Gujarat, including Sardar

economic pragmatism: Russian oil is cheap, plentiful, and accessible. But economic logic has met political backlash. US Senator Lindsey Graham recently proposed a 500 per cent tariff on nations trading with Russia, aiming to cut off the lifeblood of what he calls Putin's war machineestimated to have cost Ukraine \$400 billion, per the Kiel Institute. Sharpe leans into this narrative, interpreting India's oil purchases and naval cooperation as alignment with Moscow against the West. Yet this interpretation

overlooks a critical point: geography. India is nearly 4,000 miles from the front lines of Europe's war. Prime Minister Narendra Modi has consistently urged peace in Ukraine, but India's interests remain regional-focused on border security, energy access, and economic resilience. Unlike Europe, India does not have a belligerent Russia on its doorstep. To Europe, Russia is a bad neighbour. With 80 per cent of Russians living west of the Ural Mountains, Europe faces a persistent neighbourly threat. India, however, is separated by vast distances, with no territorial disputes or shared battlefields with Russia. This geographical divide shapes a pragmatic alignment, not rivalry, challenging the West's projection of its neighbourly anxieties onto India.

Russia: A Neighbourly Threat to Europe, Not to India To understand the West's

Ashok Shah

to OPEC. This surge reflects frustrations, one must also understand its geography. For Europe, Russia is not a distant actor—it is a revisionist power next door. The 2014 annexation of Crimea and the 2022 invasion of Ukraine displaced over 8 million people, as the UN notes. Hybrid attacks like the 2022 Nord Stream sabotage and simmering conflicts in Georgia and Moldova have intensified European insecurity.

A 2023 Chatham House report underscored this tension, pointing to Russia's proximity and history of destabilisation as central to the EU's hardened stance. This is Europe's reality—and it is not India's. New Delhi is separated from Moscow by vast geography and divergent histories. It has no territorial disputes with Russia, no competing security pacts, and no shared battlefield. Its relationship with Moscow is not one of rivalry but of steady, if pragmatic, alignment. To conflate Europe's neighbourly anxieties with India's strategic autonomy is to miss the point entirely. Branding India an enemy because of its Russia ties ignores the role the West itself played in shaping that very relationship. During the Cold War, it was Western hesitation and alignment with Pakistan that pushed India closer to Moscow. In the decades since, India has maintained a careful, multipolar approach—balancing its partnerships with Russia, the US, and other regional actors through institutions like Brics, SCO, and the Quad.

#### **WESTERN RAILWAY - VADODARA DIVISION**

#### **REPLACEMENT OF VARIOUS TYPES OF TRACTION BOND**

Tender No. EL-TRD-Tender-25-26/09

Tenders for and on behalf of The President of India are invited by Divisional Railway Manager (Electrical Tr.D) Western Railway Pratap Nagar, Vadodara 390 004 for the following works.

Name of the work with its location: Replacement of various types of traction bond in Surat Geratpur and Vadodara Godhra section of Vadodara division.

Approximate cost of the work (In Rs.): ₹20,81,340/-

Bid security (In Rs.): ₹41,700/-

Cost of Tender documents and completion period: Completio Period 12 months

Tender scheduled on: Tender Closing date 19/08/2025 and time o closing at 15-00 hrs. on the same date

Web page particulars and notice for location where complete details can be seen & address of the office and clarification: Divisional Railway Manager (Electrical Tr.D) Western Railway, Pratap Nagar, Vadodara - 390004 Web site @ www.ireps.gov.in

Like us on: 

f facebook.com/WesternRly • Follow us on: 

twitter.com/WesternRly

Suryoday Small Finance Bank Limited Regd. & Corp. office : 1101, Sharda Terraces, Plot 65, Sector – 11, CBD Belapur, Navi Mumbai – 400614. CIN: L65923MH2008PLC261472.

Under Section 13 (2) of The Securitisation And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002
Whereas the undersigned is the Authorised officer of the M/s. Suryoday Small Finance Bank Ltd. ("SSFBL") under Securitisation And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notices under Section 13(2) of the said Act, calling upon the following Borrower(s), Co-Borrower(s), Guarantor(s) to discharge in full their liability to the Company by making payment of entire outstanding including up to date interest, cost and charges within 60 days from the date of respective Notices issued and the publication of the Notice as given below as and way of alternate service upon you. As security for due repayment of the loan, the following Secured Asset (s) have been mortgaged to SSFBL by the said Borrower(s), Co-Borrower(s), Guarantor(s) respectively.

Name of Borrower / Co-Borrower/ Guarantor	Date of Demand Notice	13.06.2025	
217030002442 and 217030002443	Date of NPA	08.06.2025	
1. MR. HUSNUMIYA SHAIKH S/O GULAM MOHAMMAD SHAIKH, 2. MRS. AKSAABIBI SHAIKH W/O SHAIKH HUSUMIA, 3. MR. MOHDAMIN ANWARBHAI SHAIKH S/O ANWARBHAI GULAMMOHD SHAIKH		Rs. 10,00,405.89/- as on 09.06.2025	

Description Of Secured Asset(S) /Immovable Property (les): All The Peace And Parcel O Bearing Non-Agricultural Plot Of Land In Mauje Diwalipura, Vadodara Lying Being Land Bearing Old Survey No. 254, Block/Survey No. 172 Paiki Admeasuring 8144.50 Sq. Mtrs., C.S. No. Na 172 Paiki/9 Known As "Aarzu Bungalows" Plot/Block No. A/14, Plot Admeasuring 47.06 Sq. Mtrs., Undivided Share Of Road & Cmmon Plot Admeasuring 45.34 Sq. Mtrs., Total Measuring 92.40 Sq. Mtrs., Construction Admeasuring 55.38 Sq. Mtrs., A Registration District Vadodara & Sub District Vadodara & District Vadodara, And Bounded As Under: East: By Land Of Block No. 172 Paiki, West: By 9 Mtrs, Road, North: By Land Of v Land Of Plot No. A-15

	Date of Demand Notice	13.06.2025
1. MR. PATEL KETANKUMAR FULCHANDBHAI S/O FULCHAND GANGARAM	Date of NPA	08.06.2025
PATEL, 2. MRS. NEHALBEN KETANKUMAR PATEL W/O PATEL KETANKUMAR	Total Outstanding	Rs. 44,44,872.37/- as on 09.06.2025

Description Of Secured Asset(S) /Immovable Property (les): All The Piece And Parcel Of Immovable Residential Property Being At R.S. No. 14/2 Paiki, Constructed House On Plot No. 6 Paiki South Side Admeasuring Total 317.71 Sq. Mtr. Built Up Area 81.30 Sq. Mtr. Situated At Mouje Himmatnagar Motipur Taluka Himmatnagar District Sabarkantha In Registration Sub District Himmatnagar Dist. And Which Is Bounded As Follow: North: As Pe Plan Plot No. 6 Paiki Remain Land, South: As Per Plan Plot No. 7, East: As Per Plan Road Plot No. 16, West: As Per Plan Plot No. 2. Place : Gujarat, Date : 19.07.2025 Authorised Officer, Suryoday Small Finance Bank Limiter

KIFS Housing Finance Limited

Registered Office: 6th Floor, KIFS Corporate House, Beside Hotel Planet Landmark, Near Ashok Vatika, BRTS, ISKON - Ambili Road, Bodakdev, Ambli, Ahmedabad, Gujarat-380054 Corporate Office: C-902, Lotus Park, Graham Firth Compound, Western Express Highway, Goregaon (East), Mumbai - 400063, Maharashtra, India. Ph. No.: +91 22 61796400 E-mail: contact@kifshousing.com
Website: www.kifshousing.com CIN: U65922GJ2015PLC085079 RBI COR: DOR-00145

Appendix IV Symbolic Possession Notice (For Immovable Property)
Whereas, the undersigned being the authorized officer of Kifs Housing Finance Limited (KHFL) under the Secritisation and Reconstruction
of Financial Assests and Enforcement of Security Interest Act 2002 and in exercise of power conferred under section 13(2) read with Rule
3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by Authorized Officer of the Ompany to the Borrower(S) /
Guarantor(S) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice here by given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described here in below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement rules, 2002. The Borrowers attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets. The Borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the change of KIFS for an amount as mentioned herein under with the interest thereon.

	Sr. No.	Name of Borrower/Co- Borrower/Guarantors & Date of NPA	/ Amt. Outstanding / Branch LAN	Detail of Secured Assets:	Possession Notice Date/Type
	1	1. JALU MANASHIBHAI JILUBHAI (Applicant) 2. KAMLABEN MANSHIBHAI JALU (Co-Applicant 1) NPA - April 10, 2025	- May 09, 2025	House no.333 , Near Primary School, village- Karadi, ta- sayla ,dist-Surendranagar, Gujarat, India, 363440. <b>Boundaries as Per</b>	
			U/S - KS. 83008//-	Jaiubilai, <b>Nortii -</b> Roau & Aapabilai Kalbilai Vegau, <b>Soutii -</b> Opeli	July 15, 2025 (Symbolic)
			RAIKOT / 28772 /	Plot Of Magalubhai, <b>As per Site - East1 -</b> Vaskurbhai Jalu, <b>West1 -</b> Open Plot Of Jalubhai, <b>North 1 -</b> Road & Aapabhai Kalbhai Vegad, <b>South1 -</b> Open Plot Of Magalubhai	(Symbolic)
	2	1. HITENDRABHAI GOMANBHAI PARMAR (Applicant) 2. GOMANBHAI RAMABHAI PARMAR (Co-Applicant 1) 3. CHANCHALBEN GOMANBHAI PARMAR (Co-Applicant 2) NPA - April 10, 2025	Demand Notice Date - May 09, 2025	MILKAT NO 245 NAVI VASAHAT BHADKODRA ANKLESHWAR BHARUCH, , NEAR PARMAR FALIYU, BHARUCH, GUJARAT, IND . LandMark . BHARUCH ANKLESVAR GUJARAT 393001 Boundaries as Per Sale Deed - East - RADHE RESIDENCY, West J - SOCIETY ROAD, North - DALPATBHAI CHHITABHAI PARMAR PROPERTY, South - HOUSE OF RAMJIBHAI GOMANBHAI. As per Site - East I - BACK ADJ. PROPERTY, West1 - SOCIETY ROAD, North1 - ADJ. PLOT, South1 - ADJ. PLOT	
			Branch / LAN - ANKLESHWAR / 4279 /		July 15, 2025 (Symbolic)
	3	1. KALPESH VINOD BARAD (Applicant) 2. BARAD VISHAKHABEN KALPESHBHAI (Co-Applicant 1) NPA - April 10, 2025	- May 09, 2025	PLOT NO.151 PAIKI SOUTH SIDE LAND 50-00SE.MTRS, KHASRA NO.42471,GATE NO.4, AANANDDHAM TOWNSHIP,GATE NO.04, GADHADA ROAD, BOTAD CITY, Gujarat, India, 364710 Boundaries as Per Sale Deed - East - LAGU PLOT NO.: 146,	
7			U/S - KS. 58108/.0/-		
			SURENDRANAGAR /	West - LAGU 6.00 M ROAD, North - LAGU REMAINING LAND OF THIS PLOT, South - LAGU PLOT NO:: 150, As per Site - East1 - LAGU PLOT NO:: 146, West1 - LAGU 6.00 M ROAD, North1 - LAGU REMAINING LAND OF THIS PLOT, South1 - LAGU PLOT NO:: 150	(Symbolic)
1	4	1.KALPESH VINOD	- May 09, 2025	PLOT NO.151 PAIKI SOUTH SIDE LAND 50-00SE.MTRS, KHASRA NO.424/1,GATE NO.4, AANANDDHAM TOWNSHIP,GATE NO.04,	
ĺ	BARAD Applicant) 2. VISHAKHABEN		GADHADA ROAD, BOTAD CITY, Gujarat, India, 364710.  Boundaries as Per Sale Deed - East - Lagu plot no.146, West -	July 15, 2025	
		KALPESHBHAI BARAD (Co-Applicant 1) NPA - April 10, 2025	AHMEDABAD / 1043735 /	Lagu 6.0m road, <b>North</b> - Lagu remaining land of this plot paikee, <b>South</b> - Lagu plot no: 150, <b>As per Site</b> - <b>East1</b> - Lagu plot no.146, <b>West1</b> - Lagu 6.0m road, <b>North1</b> - Lagu remaining land of this plot paikee, <b>South1</b> - Lagu plot no: 150.	(Śymbolic)
	5	1. VISHNUBHAI MATHURBHAI KOLCHA		122 NAVA FALIYU CHUNDHELI NEAR BUS STAND CHUNDHELI CHHOTAUDAPUR GUJARAT 391140, , NEAR BUS STAND, Vadodara, Gujarat, India, 391140. <b>Boundaries as Per Sale Deed - East</b> -	
		(Applicant) 2. TAMANNABEN KOLI (Co-Applicant 1) NPA - February 10, 2025		House of Chaturbhai Bhikahbhai Koli, West - House of Viththabhai	
			Branch / LAN - ANKLESHWAR / 5755	Chhaganbhai, <b>North</b> - Internal Road, <b>South</b> - House of Bharatbhai Naranbhai, <b>As per Site - East1</b> - House of Chaturbhai Bhikabhbai Koli, <b>West1</b> - House of Viththabhai Chhaganbhai, <b>North1</b> - Internal Road, <b>South1</b> - House of Bharatbhai Naranbhai	(Symbolic)

Borrower(s)/Guarantor's are hereby put to caution that the property may be sold at any time herein after by way of public auction/tenders and as such this may also be treated as a notice under Rule 6, 8 & 9 of Security (interest) Enforcement Rules, 2002 The detailed inventory and Panchnama could not be recorded due to obstructions as such property has been photographed. Date - 19.07.2025. Place - Guiarat Authorized officer, KIFS Housing Finance Limited

#### **VARIOUS ENGINEERING WORKS** E-TENDER NOTICE NO. DRM-BRC 079 TO 080 OF 2025-26

Sealed Tenders for and on behalf of the President of India are invited by Divisional Railway Manager

**WESTERN RAILWAY-VADODARA DIVISION** 

(WA/C), Western Railway, Pratapnagar, Vadodara-390 004 for the following works. **Bid Security to** Tender be deposited (In Rs.) Name of Work No. DRM BRC Vadodara (P):- Improvement of Guard Lobby 57.73.220.10 1.15.500.00 079 of at PF-6. 2025-26 DRM BRC Vadodara Division:- Improvement of Pratapnagar, Vishwamitri, and Vadodara Yard Colony by 4,64,81,267.40 080 of 3,82,400.00 2025-26 | account (PRTN-150, VS-50, BRCY-150)

Date and time for submission of tender and opening of tender: Tender is to be submitted on 06.08.2025 before 15.00 Hrs and is to be opened on same date at 15.30 Hrs. Website particulars and notice for the location where complete details can be seen & Address of the office from where the tender form can be purchased: Web sites: www.ireps.gov.in. Divisional Railway Manager (WA/C) Western Railway, Pratapnagar, Vadodara -390 004. **BRC 111** 

Like us on: 

f facebook.com/WesternRly • Follow us on: 

twitter.com/WesternRly

#### **ASHNISHA INDUSTRIES LIMITED**

CIN- L74110GJ2009PLC057629

Regd. Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Ahmedabad-380006. Gujarat, India. Phone No.: 079-26463227

**E-mail ID:** ashnishalimited@gmail.com • **Website:** www.ashnisha.in

NOTICE is hereby given that the 16th Annual General Meeting (AGM) of the members of the Company will be held on **Tuesday**, **12th August**, **2025** at **3:30 P.M. IST** through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the notice of AGM in compliance with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 19/ the businesses as set out in the notice of AGM in compliance with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 19/2021, 21/2021, 02/2022, 11/2022, 09/2023 and 09/2024 dated 8th April 2020, 13th April 2020, 5th May 2020, 13th January 2021, 8th December 2021, 14th December 2021, 14th December 2021, 5th May, 2022, 28th December, 2022, 25th September, 2023 and 19th September, 2024, respectively issued by the Ministry of Corporate Affairs ('MCA') (collectively referred to as 'MCA Circulars') and Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62, SEBI/HO/CFD/PD-2P/CIR/2023/167 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2024/133 and dated 12th May, 2020, 15th January, 2021, 13th May, 2022, 5th January, 2023, 7th October, 2023 and 3rd October, 2024 respectively issued by the Securities and Exchange Board of India (collectively referred to as 'SEBI Circulars') Pursuant to Provision of Section 91 of the Companies Act, 2013 and as per provisions of Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer books of the company shall remain closed from Thursday, 7th August, 2025 to Tuesday, 12th August, 2025 (Both days inclusive). In compliance with MCA Circulars and SEBI Circular, the Notice of AGM along with the Annual Report for the financial year 2024-25 have been sent in electronic mode only to all those members whose e-mail Ids are registered with the Company or the Registrar and Share Transfer Agent or their respective Depository Participant(s). Further, as per Regulation 36(1)(b) of listing regulations as

and Share Transfer Agent or their respective Depository Participant(s). Further, as per Regulation 36(1)(b) of listing regulations as mended, the web-link, including the exact path, where complete details of Annual Report are available is being sent to those embers who have not registered their email IDs.

n compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members, the facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means on all the businesses set forth in the Notice of the AGM through the remote e-voting Services provided by CDSL.

The detailed instructions for remote e-voting facility are contained in the Notice of the AGM which has been sent to the Members

the details pursuant to the provisions of Companies Act, 2013 and Rules are given hereunder:

Cut-off date for the purpose of remote e-voting is Wednesday, 6th August, 2025.

Period of e-voting: E-voting shall commence from 9:00 A.M. on 9th August, 2025 and ends at 5:00 P.M. on 11th August,

2025. Please note that remote e-voting will not be allowed beyond the above mentioned time and date.

Persons who have acquired shares and become member of the Company after dispatch of Notice of the AGM and holding shares as on the cut-off date i.e. Wednesday, 6th August, 2025, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of AGM.

A person, whose name appears in the Register of Members or in the Register of Beneficial owners maintained by the depositories as on cut-off date only, shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM. However, if the person is already registered with CDSL for remote e-voting, then the existing User ID and Password can be

used for casting votes.

Members attending AGM through VC/OAVM facility, who have not casted their votes by remote e-voting shall be able to

cast their votes through e-voting at the AGM.

Members who have casted their votes by remote e-voting, may also attend the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their votes again at the AGM. not be entitled to cast their votes again at the AGM.

The procedure for e-voting, attending the AGM through VC/OAVM facility and Registration of E-Mail ID by shareholders has been provided in the Notice of AGM. The same is available on the website of the Company: www.ashnisha.in, website of Central Depository Services Limited at www.evotingindia.com and at the website of BSE Limited: www.bseindia.com.

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the CDSL e-voting System, you can write an

ff you have any queries or issues regarding adentiting Agin a Carooning from the content of the series of the content of the series of the content of the co By order of Board

Place: Ahmedabad

Sr.No

1

2

3

Managing Director DIN: 02467830 mahindra Home Finance

Corporate Office: Unit No.203, Amiti Building, Agastya Corporate Park, Kamani Junction, Opp. Fire Station, L.B.S Marg, Kamani, Kurla West, Mumbai - 400 070 Registered office: Mahindra Towers, P. K. Kurne Chowk, Worli, Mumbai, Maharashtra – 400 018 | CIN - U65922MH2007PLC169791

	We hereby notify the Shifting of the below branches with effect from 18.10.2025				
SHIFTING OF THE BELOW BRANCHES					
	SHIFTING BRANCH ADDRESS (FROM)	SHIFTING BRANCH ADDRESS (TO)			
	HIMMATNAGAR: 1st Floor, Vraj Complex, Near Town Hall,	1st Floor Shop No 53, One World, Polytechnic College,			
	Opp Pratapgadh, Petrol Pump, Himmatnagar, Gujarat-383001	Char Rasta, Shamalaji Highway, Motipura, Himmatnagar, Gujarat -38300			
	NADIAD: 201-203 Shiv Point 2nd Floor, Opp Desai Park	Shop No 105, First Floor, Petlad Road, Nadiad,			
	Society College Road, Nadiad, Gujarat, 387001	Kheda, Gujarat 387002			
	THARAD: 1st Floor, Opp Bsnl Office, Near Taluka	1st Floor, Opp Bsnl Office, Near Taluka			
	Panchayat, Police Station Road, Tharad, Gujarat-385565	Panchayat, Police Station Road, Tharad, Gujarat-385565			

The operations from the above mentioned branch shall be shifted after the effective date. All the customers are Authorised Officer, Mahindra Rural Housing Finance Limited Date: 19-07-2025

in the state. While 78 dams have been put on high alert, alert and warning mode. Out of these 78 requested to make a note of the same dams, 40 dams are on high alert.